

ધ રોલાન્ડ યુનિવર્સલ ડીમેન્શીયા અસેસમેન્ટ સ્કેલ

તારીખ: ____ / ____ / ____

દર્દીનું નામ: _____

વિષય	મહત્તમ સ્કોર
<p>સ્મરણ શક્તિ (મેમરી)</p> <p>૧. (સૂચન) હું ઈચ્છું છું કે તમે કલ્પના કરો કે આપણે ખરીદી કરવા જઈ રહ્યા છીએ. અહીં કરિયાણાની વસ્તુઓની સૂચિ છે. હું ઈચ્છું છું કે તમે નીચેની વસ્તુઓ યાદ રાખો જે આપણે દુકાનમાંથી મેળવવાની જરૂર છે. જ્યારે લગભગ ૫ મિનિટમાં દુકાન પર પહોંચીશું ત્યારે હું તમને પૂછીશ કે આપણે શું ખરીદવું છે. તમારે મારા માટે સૂચિ યાદ રાખવાની છે</p> <p>યા, ખાદ્ય તેલ, ઈંડા, સાબુ કૃપા કરીને મારા માટે આ સૂચિનું પુનરાવર્તન કરો (વ્યક્તિને ૩ વાર યાદીનું પુનરાવર્તન કરવા માટે કહો). (જો વ્યક્તિએ ચારેય શબ્દોનું પુનરાવર્તન ન કર્યું હોય, તો જ્યાં સુધી વ્યક્તિ તે શીખી ન જાય અને તેને પુનરાવર્તિત કરી શકે ત્યાં સુધી સૂચિનું પુનરાવર્તન કરો, અથવા, વધુમાં વધુ પાંચ વખત.)</p>	
<p>વિઝ્યુલાઇઝિંગ ઓરિએન્ટેશન</p> <p>૨. હું તમને શરીરના જુદા જુદા ભાગોને ઓળખવા/બતાવવા માટે કહીશ. (સાયો = ૧). એકવાર વ્યક્તિ આ પ્રશ્નના ૫ ભાગોનો સાયો જવાબ આપી દે, પછી ચાલુ રાખશો નહીં કારણ કે મહત્તમ સ્કોર ૫ છે.</p> <p>(૧) મને તમારો જમણો પગ બતાવો૧</p> <p>(૨) મને તમારો ડાબો હાથ બતાવો૧</p> <p>(૩) તમારા જમણા હાથથી તમારા ડાબા ખભાને સ્પર્શ કરો૧</p> <p>(૪) તમારા ડાબા હાથથી તમારા જમણા કાનને સ્પર્શ કરો૧</p> <p>(૫) મારો ડાબો ઘૂંટણ બતાવો (સૂચવો/નિર્દેશ કરો)૧</p> <p>(૬) મારી જમણી કોણી બતાવો (સૂચવો/નિર્દેશ કરો)૧</p> <p>(૭) તમારા જમણા હાથથી મારી ડાબી આંખ તરફ નિર્દેશ કરો</p> <p>(૮) તમારા ડાબા હાથથી મારો ડાબા પગનો પંજા તરફ નિર્દેશ કરો</p>/૫
<p>વ્યવહાર</p> <p>૩. હું તમને મારા હાથ વડે એક ક્રિયા/વ્યાયામ બતાવવા જઈ રહ્યો છું. હું ઈચ્છું છું કે તમે મને જુઓ અને હું જે કરું તેની નકલ કરો. જ્યારે હું આ કરું ત્યારે મારી નકલ કરો. . . (એક હાથ મુઠ્ઠીમાં, બીજી હથેળી ટેબલ પર નીચે - વારાફરતી.) હવે તે મારી સાથે કરો: હવે હું ઈચ્છું છું કે જ્યાં સુધી હું તમને</p>	

રોકવા માટે ન કહું ત્યાં સુધી તમે આ ગતિએ આ ક્રિયા કરતા રહો - લગભગ ૧૦ સેકન્ડ. (મધ્યમ ચાલવાની ગતિએ પ્રદર્શન કરો).

આ રીતે સ્કોર:

સામાન્ય = ૨

(જો કો ઈ ભૂલો હોય તો બહુ ઓછા; સ્વ-સુધારેલ, ક્રમશઃ વધુ સારું; સારી જાળવણી; હાથ વચ્ચે સુમેળનો ખૂબ જ ઓછો અભાવ)

આંશિક રીતે પર્યાપ્ત = ૧ (સ્વ-સુધારાના કેટલાક પ્રયાસો સાથે નોંધનીય ભૂલો; જાળવણીના કેટલાક પ્રયાસો; નબળી સુમેળ)

નિષ્ફળ = ૦ (કાર્ય કરી શકાતું નથી; કોઈ જાળવણી નથી; કોઈ પ્રયાસ નથી)

...../૨

વિઝ્યુઓકન્સ્ટ્રક્શનલ ડ્રોઇંગ

૪. કૃપા કરીને આ ચિત્ર બરાબર દોરો જેમ તે તમને દેખાય છે (પૃષ્ઠની પાછળ ક્યુબ બતાવો). (હા = ૧)


આ રીતે સ્કોર:

(૧) શું વ્યક્તિએ ચોરસ પર આધારિત ચિત્ર દોર્યું છે?

.....૧


(૨) શું વ્યક્તિના ચિત્રમાં બધી આંતરિક રેખાઓ દેખાય છે?

.....૧



(૩) શું વ્યક્તિના ચિત્રમાં બધી બાહ્ય રેખાઓ દેખાય છે?

.....૧



...../૩

નિર્ણય

૫. તમે વ્યસ્ત શેરીની બાજુમાં ઉભા છો. ત્યાં કોઈ રાહદારી ક્રોસિંગ નથી અને ટ્રાફિક લાઇટ નથી.

મને કહો કે તમે રસ્તાની બીજી બાજુ સુરક્ષિત રીતે જવા માટે શું કરશો. (જો વ્યક્તિ અપૂર્ણ પ્રતિસાદ આપે છે જે જવાબના બંને ભાગોને સંબોધિત કરતું નથી, તો પૂછો: «શું તમે બીજું કંઈ કરશો?») દર્દી શું કહે છે તે બરાબર રેકોર્ડ કરો અને પ્રતિસાદના તમામ ભાગોને વર્તુળ કરો જે પૂછવામાં આવ્યા હતા.

.....
.....

આ રીતે સ્કોર:

શું વ્યક્તિએ સૂચવ્યું હતું કે તેઓ ટ્રાફિકની શોધ કરશે? (હા = ૨; હા સંકેત = ૧; ના = ૦) .

.....૨

શું વ્યક્તિએ કોઈ વધારાની સલામતી દરખાસ્તો કરી હતી? (હા = ૨; હા સંકેત = ૧; ના = ૦)

.....૨

...../૪

<p>મેમરી રિકોલ</p> <p>૧. (યાદ કરો) અપણે હમણાં જ દુકાન પર આવ્યા છીએ. શું તમે કરિયાણાની યાદી યાદ રાખી શક્યા છો જે આપણે ખરીદવાની જરૂર છે? (સુચન : જો વ્યક્તિ સૂચિમાંથી કોઈ પણ યાદ ન કરી શકે, તો કહો કે «પ્રથમ 'યા' હતી.»)</p> <p>(કોઈપણ આઇટમ માટે ૨ પોઈન્ટ સ્કોર આપો જેનું સુચન કરવામાં આવ્યું ન હોય – માત્ર 'યા'નો ઉપયોગ સુચન તરીકે કરો.)</p> <p style="text-align: right;">યા ખાદ્ય તેલ૨ ઇંડા૨ સાબુ૨૨</p> <p>ભાષા</p> <p>૬. હું તમને એક મિનિટ માટે સમય આપવા જઈ રહ્યો છું. તે એક મિનિટમાં, હું ઈચ્છું છું કે તમે મને તમારાથી બને તેટલા વિવિધ પ્રાણીઓના નામ જણાવો. અમે જોઈશું કે તમે એક મિનિટમાં કેટલા જુદા જુદા પ્રાણીઓના નામ આપી શકો છો. (જો જરૂરી હોય તો સૂચનાઓનું પુનરાવર્તન કરો). આ આઇટમ માટે મહત્તમ સ્કોર ૮ છે. જો વ્યક્તિ એક મિનિટ કરતાં ઓછા સમયમાં ૮ નવા પ્રાણીઓનું નામ આપે છે તો તેને ચાલુ રાખવાની જરૂર નથી.</p> <p>૧..... ૫..... ૨..... ૬..... ૩..... ૭..... ૪..... ૮.....</p>		<p style="text-align: right;">...../૮</p> <p style="text-align: right;">...../૮</p>
<p>કુલ સ્કોર =</p>		<p style="text-align: right;">130</p>

